

**B.Com. Semester - 6 (CBCS) Examination
May/June-2021 (NEW COURSE)
Corporate Tax Planning - 2 Dse-1 (New)**

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૩ સમજાવો. (૧) ડબલ ટેક્સેશન રિલિફ (૧૪)
- (૨) એડવાન્સ રુલીંગ્સ
- પ્રશ્ન.૪ શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૫ નોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
1. કાયદા હેઠળ કામદારોનું મહેનતાણું
 2. કાયદા હેઠળ વૈજ્ઞાનિક સંશોધનની સમજૂતી
 3. એડવાન્સ પ્રાઈસિંગ એગ્રીમેન્ટ
 4. સંયોજનનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ

ENGLISH VERSION

- Q.1 Explain corporate Tax Planning with reference to Employees Remuneration with Example. (14)
- Q.2 Explain Corporate Tax Planning with reference to sale of scientific Research assets with Example. (14)
- Q.3 Explain: (1) Double Taxation Relief (14)
- (2) Advance Rulings
- Q.4 Explain about Transfer of assets between holding and subsidiary companies. (14)
- Q.5 Write notes. (any two) (14)
1. Employees Remuneration under the Act.
 2. Explanation of scientific Research under the Act.
 3. Advance Pricing Agreement
 4. Corporate Tax Planning with Reference of Amalgamation
